

પ્રકરણ-૬ (નિયમ સંગ્રહ-૭)

તેના ભાગ તરીકે રચાયેલી બોર્ડ, પરિષદ, સમિતિઓ અને અન્ય સંસ્થાઓનું પત્રક:-

૭.૧ જાહેર તંત્રને લગતા બોર્ડ, પરિષદો, સમિતિઓ અને અન્ય મંડળો અંગેની વિગત નીચેના નમૂનામાં આપો.

વિગત	માહિતી
માન્યતા પ્રાપ્ત સંસ્થાનું નામ અને સરનામું:-	મેનેજીંગ ડીરેક્ટરશ્રી, ડી.આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ (અનુ.જાતિ), બ્લોક નં.૨, ડી-૨ વિંગ, ચોથો માળ, કર્મયોગી ભવન, ગુજરાત રાજ્ય, ગાંધીનગર ફોન નંબર-૦૭૯- ૨૩૨૫૬૩૨૬ (ફેક્સ) ૨૩૨૫૬૩૨૩,
માન્યતા પ્રાપ્ત સંસ્થાનો પ્રકાર (બોર્ડ, પરિષદ, સમિતિઓ, અન્ય મંડળો):-	બેચર સ્વામી અતિપછાત જાતિ વિકાસ બોર્ડ, ગાંધીનગર સોસાયટી રજીસ્ટ્રેશન એક્ટ-૧૯૬૦ નો ૨૧ મો અધિનિયમ) હેઠળ નોંધણી નંબર ગુજ/૧૦૬૨/ગાંધીનગર, તા.૩૧/૫/૦૦૩ અને મુંબઈ સાર્વજનિક ટ્રસ્ટ એક્ટ-૧૯૫૦ (સન ૧૯૫૦ ના મુંબઈના ૨૯ માં) અન્વયે સાર્વજનિક ટ્રસ્ટોના રજીસ્ટ્રેશનમાંના નં. એફ/૧૦૧૮/ગાંધીનગર, તા.૩૧/૫/૨૦૦૩
માન્યતા પ્રાપ્ત સંસ્થાનો ટુંકો પરિચય (સંસ્થાપના વર્ષ/ઉદ્દેશ/મુખ્ય પ્રવૃત્તિઓ)	ગુજરાત સરકારશ્રીના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગનાતા .૨૬/૬/૨૦૦૧નાઠરાવક્રમાંકઅવક/૧૦૯૮/૨૨૦૧/જ થી અનુસૂચિત જાતિઓમાં સૌથી વધારે પછાત (૧)હાડી (૨)નાડીયા (૩)સેનવા (૪) તુરી(પ)ગરો (૬)વણકર સાધુ (૭)અનુ.જાતિના બાવા જેવી અતિપછાત જાતિના લોકો અન્ય જાતિઓની સરખામણીમાં ચોકકસ પ્રગતિ કરી શકે અને તેમનો આર્થિક ઉત્કર્ષ થઈ શકે તે માટે અતિપછાત જાતિ વિકાસ બોર્ડ ની રચના કરેલ છે. સરકારશ્રીના તા.૧૫/૧૨/૨૦૦૪ ના ઠરાવ ક્રમાંક અપજ/૧૦૨૦૦૨/૧૦૫૦/હ થી નક્કી કરેલ અતિપછાત જાતિઓની વિગત પ્રમાણે (૧)તુરી-બારોટ (૨)તીરગર-તીરબંદા (૩) થોરી (૪)માતંગ (૫) વાલ્મિકી વિગેરે જાતિઓનો ઉમેરો થયેલ છે. આમ, અતિપછાત બોર્ડમાં ૧૨ (બાર) જાતિઓનો સમાવેશ થયેલ છે. ૧. આ બોર્ડનો ઉદ્દેશ રાજ્ય સરકાર તથા અનુ.જાતિ વિકાસ નિગમ અને નિયામકશ્રી અનુ.જાતિ કલ્યાણ, ખાતાના સંપર્કમાં રહીને અતિપછાત જાતિનો લોકોના આર્થિક સામાજિક અને સાંસ્કૃતિક તેમજ શૈક્ષણિક વિકાસ માટે કાર્યવાહી કરવાની રહેશે. ૨. આ જાતિના લોકોના આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક

	<p>તેમજ શૈક્ષણિક વિકાસ માટે પગલાં સૂચવવાનો રહેશે.</p> <p>૩. અનુસૂચિત જાતિઓ માટેના વિકાસ માટેની યોજનાઓના મૂળભૂત આશય સાથે સુસંગત રહી અતિપછાત જાતિઓ માટે આ યોજનાઓના અસરકારક અમલ માટે જરૂરી સલાહ સૂચન કરશે.</p> <p>૪. અતિપછાત જાતિઓના આર્થિક વિકાસ અંગે આર્થિક ઉપાર્જન થાય તેવી યોજનાઓ અને તે અંગેની તાલીમ અંગે સલાહ આપશે.</p> <p>૫. સરકાર તરફથી ઉપરોક્ત હેતુઓ માટે સોંપવામાં આવે તે અન્ય કામગીરી આ બોર્ડ દ્વારા કરવાની રહેશે.</p>
માન્યતા પ્રાપ્ત સંસ્થાની ભૂમિકા (સલાહકાર /સંચાલક/કાર્યકારી/અન્ય):-	બોર્ડની રચના સલાહકાર બોર્ડ તરીકે કરવામાં આવેલ છે. આ બોર્ડ ડા.આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ (અનુ.જાતિ)ની છત્રછાયામાં અને તેના સંપર્કમાં રહી કામગીરી કરશે. તેમજ જરૂર જણાયે નિયામકશ્રી અનુ.જાતિ કલ્યાણ ખાતાની કચેરીઓની સહાય લઈ કામગીરી કરશે.
માળખુ અને સભ્યનું બંધારણ:-	બોર્ડની કુલ સભ્ય સંખ્યા ૨૪ રહેશે. જેમાં ૧૫ બિનસરકારી સભ્ય રહેશે. જેમાં ઓછામાં ઓછા ૨ મહિલા સભ્યો રહેશે. ૯ સરકારી સભ્યો રહેશે. બિનસરકારી સભ્યો પૈકી એક અધ્યક્ષ અને એક ઉપાધ્યક્ષ રહેશે.
સંસ્થાના વડા:-	અધ્યક્ષ, ડા.આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ (અનુ.જાતિ), ગાંધીનગર
મુખ્ય કચેરી અને તેની શાખાઓના સરનામાં:-	ડા.આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ (અનુ.જાતિ), બ્લોક નં.૨, ડી-૨ વિંગ, ચોથો માળ, કર્મચોગી ભવન, ગુજરાત રાજ્ય, ગાંધીનગર
બેઠકોની સંખ્યા:-	દર ત્રિમાસિક બોર્ડ બેઠક બોલાવવામાં આવે છે.
શું જનતા બેઠકોમાં ભાગ લઈ શકે છે.	ના
શું બેઠકોની કાર્યનોંધ તૈયાર કરવામાં આવે છે.	હા
બેઠકોની કાર્યનોંધ જનતાને ઉપલબ્ધ છે. જો તેમ હોય તો તે મેળવવા માટેની પદ્ધતિની માહિતી આપો.	ના, પરંતુ જાહેર જનતાની માંગણી હોય તો નિયત ફી ભરવાથી માહિતી અધિનિયમ-૨૦૦૫ માં કરેલ જોગવાઈ મુજબ જાહેર જનતા માટે ઉપલબ્ધ કરી શકાય.